

B.A. Semester - 4 (CBCS) Examination

March/April- 2019

ECONOMICS: P9 ECONOMICS OF PUBLIC FINANCE - 2
(Elective-2)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	મહત્તમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત આકૃતિ દ્વારા સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૧	પરોક્ષ કર એટલે શું? પરોક્ષ કરનાં લાભ અને ગેરલાભ સમજાવો.	
પ્રશ્ન-૨	જાહેર અર્થવિધાનનો અર્થ આપી, જાહેર અર્થવિધાનનું કાર્યક્ષેત્ર સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૨	જાહેર ખર્ચની ઉત્પાદન અને વહેંચણી પરની અસરો સમજાવો.	
પ્રશ્ન-૩	કરદાનક્ષમતા એટલે શું? કરદાનક્ષમતાને અસર કરતાં પરિબલો સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૩	કરાઘાત, કરસંપાત અને કરવિવર્તનનાં ખ્યાલો ઉદાહરણ આપી સમજાવો.	
પ્રશ્ન-૪	જાહેર ખર્ચનો અર્થ આપી, જાહેર ખર્ચનાં વૃદ્ધિ થવાનાં કારણો વર્ણવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૪	પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનો અર્થ અને તફાવત સમજાવો.	
પ્રશ્ન-૫	ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)	(૧૪)
	(૧) ઉત્તમ કર પદ્ધતિનાં લક્ષણો. (૨) પ્રત્યક્ષ કરવેરાનાં લાભ.	
	(૩) કરવેરાનાં સિદ્ધાંતો. (૪) જાહેર ખર્ચનાં પ્રકારો.	
ENGLISH VERSION		
Que-1	Explain the theory of maximum social welfare with diagram.	(14)
	OR	
Que-1	What is Indirect tax? Explain the advantages and disadvantages of indirect tax.	
Que-2	Give the meaning of public finance and explain the scope of public finance.	(14)
	OR	
Que-2	Explain the effect on production and distribution of public expenditure.	
Que-3	What is taxable capacity? Explain the factor affecting to taxable capacity.	(14)
	OR	
Que-3	Explain the concept of Impact of taxation, Incidence of taxation and shifting of taxation with help of illustration.	
Que-4	Give the meaning of public expenditure and describe the causes of growth in public expenditure.	(14)
	OR	
Que-4	Explain the meaning and difference between direct and indirect taxes.	
Que-5	Write short notes. (any two)	(14)
	(1) Characteristics of best tax system.	
	(2) Advantages of direct tax.	
	(3) Principles of taxation.	
	(4) Types of public expenditure.	